



Corporate Office: 15,16 & 17, Maker Chambers-III, 1st Floor, Jamnalal Bajaj Road, Nariman Point, Mumbai 400 021

Tel.: 91 22 4353 0400 • E-mail: bluechiptex@gmail.com • Website: bluechiptexindustrieslimited.com

CIN: L17100DN1985PLC005561

Date: 10th August, 2023

To,
Dept. of Corporate Services (CRD) **BSE Limited**Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001

Scrip Code: 506981

<u>Subject: Newspaper Publication of Un-Audited Financial Results of the Company for the guarter ended 30<sup>th</sup> June, 2023</u>

Dear Sir / Madam,

Pursuant to Regulation 47(3) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith copies of newspaper advertisement published in Business Standard (English) and Western Times (Gujarati) on 10<sup>th</sup> August, 2023, pertaining to the Un-audited Financial Results of the Company for the quarter ended 30<sup>th</sup> June, 2023.

The above information is also available on the website of the Company at www.bluechiptexindustrieslimited.com.

Kindly take the above on your record and disseminate the same for the information of investors.

Thanking you.

Yours faithfully,
For Blue Chip Tex Industries Limited

Mr.Durgesh .S.Shirsate Company Secretary & Compliance Officer Membership No.: ACS 69724

Encl: as above

PIMPALGAON BASWANT BRANCH

POSSESSION NOTICE SEE RULE 8 (1) (FOR IMMOVABLE PROPERTY)

Whereas: The undersigned being the Authorised Officer of the CANARA BANK, PIMPALGAON BASWANT BRANCH under Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 19/05/2021 calling upon the BORROWER/S M/S. SHAHA ELECTRICALS AND MACHINARY PROP. SWAPNIL SHRICHAND SHAHA to repay the amount mentioned in the notice, being Rs.15,38,015.11/- ( Rupees Fifteen Lakhs Thirty Eight Thousand Fifteen and Eleven Paise Only Paise Only) (As on Date 17/05/2021) with interest thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Actual / Physical Possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13(4) of the said Act, read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 on this 8th day of August of the year 2023.

The borrower's attention is invited to the provisions of Section 8 of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of CANARA BANK, PIMPALGAON BASWANT BRANCH for an amount of Rs.15,38,015.11/- (Rupees Fifteen Lakhs Thirty Eight Thousand Fifteen and Eleven Paise Only Paise Only) (As on Date 17/05/2021)+ Future Interest thereon

The Details of the property /ies mortgaged to the Bank and taken possession by the Bank are as follows

**Description of the Mortgaged Property Details:** All That and Parcel of Property Situated at

Shop No. 7, Adm Area 12.08 Sq.Mtrs, CTS No. 571, Kadari shopping Center, Grampanchayt Milkat No. 467B/3, Old Agra Road, Pimpalgaon Baswant, Tal-Niphad, Dist-Nashik. Boundaries Bounded As: East: Shop No. 08, West: Shop No. 06, South: Passage, North: Property of Mr. Narendra A Shah

Date : 08/08/2023 Sd/-Place : Pimpalgaon Baswant Authorised Officer, Canara Bank

#### **PUBLIC NOTICE** Notice is hereby given to the Public

that the Tenement No. 4/33, GOREGAON NAVJYOTI Co Operative Housing Society Ltd, Goregaon (west) Mumbai – 400104 (hereinafter referred as said tenement), The said Tenement originally allotted to R.V. KHAMBATKONE by the authorities of M.H and A.D Board. The said R. V KHAMBATKONE sold the said Flat to MR. ABDUL KADAR MOHAMMED by executing Valid Documents. The said MR. ABDUL KADAR MOHAMMED expired on 24/07/2010 and after his death the said tenement was transfer in the name of (1) SMT HAMIDA KADER MEHTAR alias HAMIDA KADER METER, (2) MRS. ANISHA M CHOKIYA (Nee ANISHA KADAR MEHTAR), (3) MRS. HASINA ARIF CHOKIYA (NEE HASINA KADAR MEHTAR), (4) MRS. SABINA PADAYA (SABINA KADAR MEHTAR) and (5) MRS.SUMAYA PHARUKH NAMAZI (NEE SUMAYA KADAR MEHTAR) and (6) MR. YUSUF KADER MEHTAR who are related to him as his wife and children. The documents which are misplace are as follow (1) Possession Letter and Allotment Letter of R.V. KHAMBATKONE, (2) The Sale Agreement Between and MR. ABDUL KADAR MOHAMMED and R.V. KHAMBATKONE. All person are hereby informed not to deal or carryout any transaction with anyone on the basis of the said missing document. If anyone has already carried out or being carried out kindly inform the undersigned in writing on the below mentioned address within 15 days from date of publication of the said Public Notice. Place: Mumbai

Date: 10.08.2023

Saba Nivaz Ansari 635,BPT Railway Line, Gate No.4, Wadala, Mumbai-37

## Mob. 8779027070

SASHWAT TECHNOCRATS LIMITED (CIN: L24220MH1975PLC018682) Regd. Office: Office no. 14, First Floor, Plumber House, 557, JSS Road, Chira Bazar,

Mumbai- 400002, Tel No. 22016021/22016031, Email id: sashwat.technocrats@gmail.com

# EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30<sup>™</sup> JUNE, 2023

PAF	PART I (Rs.in Lakhs)							
SR.			Quarter Ended					
NO.	PARTICULARS	Unaudited	Audited	Unaudited	Audited			
		30-Jun-23	31-Mar-23	30-Jun-22	31-Mar-23			
1	Total Income from Operation (Including other Income)	4.01	0.65	8.88	10.49			
2	Net Profit for the Period (before Tax, Exceptional Items and / or Extraordinary Items)	(0.77)	(34.65)	4.37	(29.58)			
3	Net Profit / (Loss) for the Period (before Tax but after Exceptional Items and / or Extraordinary Items)	(0.77)	(34.65)	4.37	(29.58)			
4	Net Profit / ( Loss) for the period after tax	(0.77)	(34.75)	3.27	(29.69)			
5	Total Comprehensive Income (Comprising Profit for the period (after tax) and other comprehensive Income (after tax)	(0.77)	(34.75)	3.27	(29.69)			
6	Paid-up Equity Share Capital (Face Value Rs.10/-)	30.62	30.62	30.62	30.62			
7	Earning per share (of Rs. 10/- each) (not annualised)							
	a) Basic	(0.25)	(11.35)	1.07	(9.70)			
	b) Diluted	(0.25)	(11.35)	1.07	(9.70)			
Note	s:							

The above Unaudited results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on 9<sup>th</sup> August, 2023 subject to 'Limited Review' by the Auditors of the company, in accordance with SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015.

The above is an extract of the detailed format of quarterly results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly financial results are available on the Stock Exchanges websites i.e. www.bseindia.com.and www.sashwattechnocrats.com

For & on behalf of the Board of Directors Sashwat Technocrats Limited

Manish Jhakalia Director

Place: Mumba Date: 09.08.2023

(DIN: 01847156)

SSF LIMITED							
Office: Flat No:102, Opel's The Iconic, D No: 9-29-7/2, Balaji Nagar, Siripuram,							
Visakhapatnam-530003, A. P., INDIA. CIN: L05001AP1968PLC094913							

	visaknapatnam-530003, A. P.,INDIA. CIN	1: LU5UU1A	P1968PLC0945	913
	Un-Audited Financial Results for the Qu	uarter ende	d 30th June	, 2023
SI. No.	Particulars	Quarter ended 30.06.2023 (Un-Audited)	Year to date Figures for the Period ended 30.06.2023 (Un-Audited)	Quarter ended 30.06.2022 (Un-Audited)
1	Income from Operations	457.91	457.91	1550.17
2	Net Profit /(Loss) for the period Before tax (after Exceptional and /or Extraordinary Items #)	13.79	13.79	48.82
3	Profit /(Loss) for the Period after tax (After Exceptional and/or Extraordinary Items)	11.17	11.17	36.02
4	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax)		10.89	36.57
5	Equity Share Capital	665.67	665.67	665.67
6	Reserves(exculding Revaluation Reserves as shown in the balance sheet of previous year)	1,043.77	1,043.77	853.20
7	Earning per equity share: (of INR 10 each) (not Annualized)			
	(1) Basic	0.17	0.17	0.54
	(2) Diluted	0.17	0.17	0.54

Notes: 1. The above is an extract of the detailed format of quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI(Listing and other Disclosure Requirements)Regulations, 2015 The full format of the Quarterly Financial Results are available on the Website of the Metropolitan Stock Exchange of India Limited (MSE) at https://www.msei.in/ and on the Company's Website at www.ssflimited.com

For SSF LIMITED

Sd/-Date: 09-08-2023 V. Padmanabham Place: Visakhapatnam Managing Director, (DIN:01246827)

	ANDHRA PRADESH EXPRESSWAY LIMITED  Regd. Office: B-376, Upper Ground Floor, Nirman Vihar, New Delhi-110092 CIN - U63031DL2005PLC349200							
SI No.	TATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER   Particulars		FOR THE STATE OF T					
NO.		30-06-2023 (Unaudited)	31-03-2023 (Unaudited)		31-03-2023 (Audited)			
1	Total Income from Operations	1,060.86	1,181.11	1,080.87	4,898.82			
2	Net Profit / (Loss) for the period	(279.70)	(418.03)	(162.66)	(2,255.91)			
	(Before Tax, Exceptional and / or Extraodinary Items)							
3	Net Profit / (Loss) for the period Before Tax	(279.70)	(418.03)	(162.66)	(2,255.91)			
	(after Exceptional and / or Extraodinary Items)							
4	Net Profit / (Loss) for the period after tax	(279.70)	(3,025.28)	(125.03)	(4,408.97)			
	(after Exceptional and / or Extraodinary Items)							
5	Total Comprehensive Income for the period (Comprising profit / (Loss)	(283.77)	(3,021.80)	(125.38)	(4,405.55)			
	for the period (after tax) and other Comprehensive Income (after tax)							
6	Paid-up equity share capital (Face value of ₹ 10 each)	1,190.01	1,190.01	1,190.01	1,190.01			
7	Other equity (Reserves excluding revaluation reserves)	(6,896.20)	(6,612.43)	(2,337.84)	(6,612.43)			
8	Security Premium Account	-	-	-	•			
9	Net worth	(5,706.19)	(5,422.42)	(1,147.83)	(5,422.42)			
10	Paid up debt capital / Outstanding debt	26,147.10	20,189.86	22,911.14	20,189.86			
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-			
12	Debt / Equity Ratio	(4.58)	(3.72)	(19.96)	(3.72)			
13	Earnings per share (EPS) ( Face value of ₹ 10/- each )							
	1. Basic	(2.35)	(25.42)	(1.05)	(37.05)			
	2. Diluted	(2.35)	(25.42)	(1.05)	(37.05)			
14	Capital Reserve	8,300.00	8,300.00	8,300.00	8,300.00			
15	Debenture redemption reserve (Refer note 6)	4,904.32	4,904.32	4,904.32	4,904.32			
16	Debt Service Coverage Ratio	0.04	0.53	0.18	0.18			
17	Interest Service Coverage Ratio	0.70	0.53	0.83	0.46			

Notes:

Place : Noida Date: August 09, 2023

website: http://www.apel.net.in/investor-relation/

- The above financial results for the period ended June 30, 2023 have been reviewed and approved by the Board of Directors in their meeting
- held on August 09, 2023. The above is an extract of the detailed format of quarterly financial results filed with the National Stock Exchange of India Limited (NSE) under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financia results is available on the websites of National Stock Exchange of India Limited (NSE) on https://www.nseindia.com and on the Compan
- For the items referred to sub clause of the Regulation 52(4) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosur Requirements) Regulations, 2015 the pertinent disclosures have been made to the National Stock Exchange of India Limited (NSE) and can be For and on behalf of the Board of Directors o Andhra Pradesh Expressway Limited

Public Notice in Form XIII of MOFA (Rule 11(9) (e)) District Deputy Registrar, Co-operative Societies, Mumbai City (3) Competent Authority under section 5A of the Maharashtra Ownership Flats Act, 1963

MHADA Building, Ground Floor, Room No. 69, Bandra (E), Mumbai-400051 No.DDR-3/Mum./deemed conveyance/Notice/2442/2023 Date: 09/08/2023

Application u/s 11 of Maharashtra Ownership Flats (Regulation of the Promotion of construction, Sale, Management and Transfer) Act, 1963 **Public Notice** 

**Application No. 83 of 2023** 

Bhagirathi Co-op. Hsg. Soc. Ltd., CTS No. 390, Sir M.V. Road, Andheri (East), Mumbai- 69 .. Applicant/s) Versus 1) Mrs Uma Mahadeo Tamboskar 2) Mr. Prakash Mahadeo Tamboskar b) Mr. Uday Mahadeo Tamboskar 4) Ms. Kalpana Mahadeo Tamboskar 5) Ms. Karuna Mahadeo Tamboskar, (Opponent No. 1 to 5 being only Legal heirs and Representatives of Late Mr. Mahadeo Soma Tamboskar Having their address at 601, Bhagirathi CHS Ltd., M. V. Road Andheri (East), Mumbai- 69. 6) M/S Matushree Developers 614, Commerce House, Nagindas Master Road, Fort, Mumbai-400023.....Opponent/s and those, whose interest have been vested in the said property may submit their say at the time of hearing at the venue mentioned above. Failure to submit any say shall he presumed that nobody has any objection to this regard and further action Description of the Property :-

#### Claimed Area

Unilateral conveyance of all that piece and parcel of land or ground together with building standing thereon now known as Bhagirathi Co-op Housing Society Limited consisting of two wings, consisting of A Wing comprising of Ground plus six upper floor having 12 flats and B Wing comprising of Ground plus six upper floor having 13 flats, thus in aggregate having 25 residential flats, together with land, hereditaments and premises situated at CTS No. 390, Sir M. V. Road, Andheri (East), Mumbai - 400 069, situate at piece and parcel of land bearing CTS No. 390, admeasuring 824.80 Sq meters of thereabouts of village Gundavali, Taluka Andheri in favour of the Applicant Society.

The hearing is fixed on Dt. 17/08/2023 at 03:00 p.m.

SEAL

(Rajendra Veer)
District Deputy Registrar,
Co-operative Societies, Mumbai City (3) Competent Authority
U/s 5A of the MOFA, 1963

PUBLIC NOTICE

Notice is hereby given that 1) Late HUKMICHAND V. SOLANKI, and 2) Late DIWALIBAI H. SOLANKI, jointly purchased Flat No. B/206, admeasuring 650 sq. ft. super built-up equivalent to i.e. 520 sq. ft. built-up area each on the 2nd Floor of B-Wing, in the building Known as "Kamal Kunj", constructed on land bearing C. S. No. 5/50 of Parel-Swree Division (Said Flat) vide Registered Agreement dated 27/12/2001 bearing the serial no. BBE3-9267-2001.

Both the above owners, Shri HUKMICHAND V. SOLANKI expired on 29/01/2008 and Smt. DIWALIBAI H. SOLANKI expired on 13/07/2019 leaving behind Mr. CHANDRAMOHAN HUKMICHAND. SOLANKI, Mrs. VIJAYA KANTILAL SURANA, Mrs. BHARTI RAMESH SURANA, Late VIJAYLAKSHMI UTTAMCHAND JAIN, Mrs. LATA VIMAL PUNMIYA and Mr. DEEPMOHAN alias DILIP HUKMICHAND SOLANKI as their only legal heirs. However, as per the Registered Deed of Will dated 23/06/2004 bearing no. BBE2-4546-2004, wherein Shri HUKMICHAND V. SOLANKI stated that after his death his share in the Said Flat shall be passed on to his grandson Mr. NISHANT DEEPMOHAN SOLANKI.

Late DIWALIBAI H. SOLANKI has filed a nomination form whereby the said societ has transferred her share equally as per nomination to her grandson Mr. NISHANT DEEPMOHAN SOLANKI, and her daughter in law Mrs. SHOBHA DEEP MOHAN SOLANKI.

The (Kamal Kunj Co-op. Housing Society Ltd.) Society has issued w.r.t the Said Flat five fully paid up shares bearing distinctive numbers from 176 to 180 (both inclusive) under Certificate No. 36 dated 16th February, 2023 issued with respect to the said Flat are free from all encumbrances, charges, disputes, claims, lien or mortgage of

All person/s having any claim/s or right in respect of the aforesaid Flat or any part thereof by way of inheritance, share, sale, mortgage, lease, lien, license, gift, possession, exchange, pledge, assignment, guarantee, trust, bequest, tenancy, transfer of title or beneficial interest, sub-tenancy, charge, lis-pendens, maintenance, easement. Court Order/s or encumbrance howsoever or otherwise are hereby called upon to intimate to the undersigned in writing of such claim with original certified copies of all supporting documents within 14 days from the date of publication of this notice, failing which the claims if any of such persons shall be treated as willfully abandoned, waived & not binding on our clients. Date: 10.08.2023,

Adv. Pratik Mukesh Sheth, Advocate High Court 292, Affinwala Building, 2nd Floor, Room No. 6. Above Anupam Hotel, S. B. S. Road, Fort, Mumbai – 400 001

### NIDO HOME FINANCE LIMITED

nereinafter referred to as Nido) (formerly known as Edelweiss Housing inance Limited), Registered Office Situated At Tower 3, 5th Floor, Wing B, ohinoor City Mall, Kohinoor City, Kirol Road, Kurla (W), Mumbai – 400070



DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SARFAESI ACT, 2002

lotice is hereby given that the following borrower/s have defaulted in the repayment of principal & interest of the loan facilies obtained by them from the Nido Home Finance Limited (hereinafter referred to as Nido) (formerly known as delweiss Housing Finance Limited) and the said loan accounts have been classified as Non-Performing Assets (NPA). The Demand notice was issued to them under Section 13(2) of The Securitisation and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act 2002(SARFAESI Act) on their last known address. In addition to said demand

otice, they have been informed by way of this public notice.

letails of the Borrowers, Securities, Outstanding Dues, Demand Notice sent under Section 13(2) and Amount claimed

Name and Address of the Borrower, Co Borrower, Guarantor And Loan Amount:

Sachin Bhange (Borrower) & Sagita Sachin Bhange (Co-borrower) H. No. 1714/7, shri Krishna Nagar, Rahivas Sangha, Ambernath (East) – 421501

LAN No: LKYNSTH0000071517

Loan agreement Date: 29-Mar-2019

oan Amount: Rs. 21,13,057/- (Rupees Twenty One lakhs Thirteen Thousand Fifty Seven Only)

NPA Date: 05-07-2023

DEMAND NOTICE DATE:- 11th July 2023

mount Due in: Rs.23,85,440.94/- (Rupees Twenty Three Lakhs Eighty Five Thousand Four Hundred Forty and Ninety

Four Paisa Only) With further interest from the date of **Demand Notice dated 11th July 2023. Details of the Secured Asset: Schedule of the Property** All that piece and parcel of Flat No.103, 1st Floor, "B Wing", building Known as "BADLAPUR PRIDE", Society known as "BADLAPUR PRIDE Co-Operative Housing Society Ltd", Badlapur (w), Tal. Ambernath, Dist: Thane- 421503, admeasuring area about 39.01 Sq.mtr. (Carpet), constructed on plot of land bearing Survey No.131, Hissa No.1 admeasuring Area 3440 Sq. Mtr. Situated at Village Badapur in the registraion District Sub- District of Thane

Name and Address of the Borrower, Co Borrower, Guarantor And Loan Amount:

sraeel Sattarali Shaikh (Borrower) & Pratibha Waghmare (Co-borrower) Flat no. 202, A. N. Con Developers, Sector 10, Plot No 139, Taloja Navi Mumbai- 410206

AN No: LPANSTH0000087872 Loan agreement Date: 31-Mar-2021

oan Amount: Rs. 18,00,000/- (Rupees Eighteen Lakhs Only)

NPA Date: 05-07-2023

DEMAND NOTICE DATE: 13th July 2023

Amount Due in: Rs.19,16,847.57/- (Rupees Nineteen Lakhs Sixteen Thousand Eight Hundred Forty Seven and Fifty even Paisa Only) With further interest from the date of Demand Notice dated 13th July 2023.

Details of the Secured Asset: Schedule of the Property All that piece and parcel of Flat No.403 on Fourth Floor, Carpet area admeasuring 35.31 Sq.meters constructed on land bearing City Survey Property No.1073, 1141 paiki Survey No.46+49/1+2+3B+1+2E, Plot No.11, admeasuring 278.80 Sq. Mtrs. Situated at Village Chinchavali Shekin, Tal. Khalapur, Dist. Raigad within the limits of Khopoli Municipal Council

ou the above Borrower/S are therefore called upon to make payment of the outstanding dues as mentioned hereinabov n full Within 60 Days of this Notice failing which the undersigned shall be constrained to take action under the SARFAESI act to enforce the above mentioned securities. Please note that as per Section 13(13) of The Said Act, You are restrained

rom transferring the above-referred securities by way of sale, lease or otherwise without our consent Sd/- Authorized Office Place: MUMBA

Date: 10 08 2023 FOR Nido Home Finance Limited

(Formerly known as Edelweiss Housing Finance Limited)

### **BLUE CHIP TEX INDUSTRIES LIMITED**

CIN: L17100DN1985PLC005561

Regd Off: Plot No. 63-B, Danudyog Sahakari Sangh Ltd., Village Piparia, Silvassa, U.T. of Dadra & Nagar Haveli - 396230 Corp Off: Office no. 15 - 17, 1st floor, Maker Chambers III, Jamnalal Bajaj Road, Nariman Point, Mumbai – 400021 Email Id: bluechiptex@gmail.com. Website: www.bluechiptexindustrieslimited.com. Tel. No.: 022-4353 0400 TRACT OF HUMINITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH HINE 2023

Sr. No.	Particulars	Quarter Ended 30.06.2023 Reviewed	Quarter Ended 31.03.2023 Audited	Quarter Ended 30.06.2022 Reviewed	Year Ended 31.03.2023 Audited
1	Total income from operation	6,123.02	5,882.89	6,704.17	25,272.40
2	Net Profit (Loss) after tax	36.22	6.89	6.95	91.20
3	Total Comprehensive income for the period	33.20	10.27	7.50	93.30
4	Equity share capital	197.05	197.05	197.05	197.05
5	Other equity	-	-	-	2,575.62
6	Earning per share (face value of Rs.10/- each)				
	Basic /Diluted :	1.84	0.35	0.35	4.63

- The above results for the quarter ended 30th June, 2023 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their meeting held on 9th August, 2023 and the same was subjected to "Limited Review" by the Statutory Auditors of the Company.
- Previous period's figures have been regrouped and reclassified, wherever necessary, to correspond with those of the current period.
- The above is an extract of the detailed format of the Quarterly Financial Results filed with the Stock Exchange under the Regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations 2015. The full format of the Quarterly Financial Results are avialable on the Stock Exchange website at www.bseindia.com and also on the website of the Company at www.bluechiptexindustrieslimited.com.

For and on behalf of the Board of Directors

CONSOLIDATED

Mr. Rahul A. Khemani **CFO & Director** DIN: 03290468

Date: 9th August, 2023

Place: Mumbai

A TATA ENTERPRISE

CIN: L24240MH1952PLC008951; Registered Office: Bombay House, 24, Homi Mody Street, Mumbai 400 001; Email Id: investor.relations@trent-tata.com; Tel: 022-67009000; Website: www.trentlimited.com.

STANDALONE

For Vear

Statement of Unaudited Standalone & Consolidated Financial Results for the Quarter ended 30th June, 2023 Rs. In Crores

Postioniese		F	or Quarter Ende	d	For Year ended	For Quarter Ended		d	For Year ended	
	Particulars	30 <sup>th</sup> June, 2023	31 <sup>st</sup> March, 2023	30 <sup>th</sup> June, 2022	31 <sup>st</sup> March, 2023	30th June, 2023	31st March, 2023	30th June, 2022	31 <sup>st</sup> March, 2023	
		Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Audited	
1	Total income from operations	2,586.20	2,206.34	1,694.37	8,126.89	2,680.39	2,268.06	1,846.98	8,502.94	
2	Net Profit/(Loss) for the quarter/ year (before tax,	192.80	124.78	132.96	710.51	212.29	66.77	146.71	555.07	
	exceptional and /or extraordinary items)									
3	Net Profit/(Loss) for the quarter/ year (before tax after	192.80	124.78	132.96	710.51	212.29	63.77	146.71	552.07	
	exceptional and /or extraordinary items)									
4	Net Profit/(Loss) for the quarter/ year (after tax after	148.27	105.13	102.62	554.57	166.67	44.95	114.93	393.63	
	exceptional and /or extraordinary items)									
5	Total Comprehensive Income after tax for the quarter/ year	149.97	104.63	102.57	399.00	169.10	51.24	114.85	245.80	
	(Comprising Profit/ (Loss) for the quarter/ year									
	(after tax) and Other Comprehensive Income(after tax))									
6	Paid-up equity share capital	35.55	35.55	35.55	35.55	35.55	35.55	35.55	35.55	
	(Face Value of Re.1 per Equity Share)									
7	Other Equity				3,044.39				2,498.51	
8	Securities Premium Account	1,924.30	1,924.30	1,924.30	1,924.30	1,924.30	1,924.30	1,924.30	1,924.30	
9	Networth	3,151.71	3,079.94	2,783.50	3,079.94	2,684.09	2,595.49	2,443.67	2,595.49	
10	Paid up Debt Capital/ Outstanding Debt	4,580.88	4,318.58	4,735.80	4,318.58	4,727.83	4,464.14	4,876.47	4,464.14	
11	Outstanding Redeemable Preference Shares									
12	Debt Equity Ratio	1.45		1.70	1.40	1.71		1.95	1.68	
13	Earning Per Share (of Re. 1/- each) (not annualised):									
	(a) Basic	4.17	2.96	2.89	15.60	4.88	1.52	3.67	12.51	
	(b) Diluted	4.17	2.96	2.89	15.60	4.88	1.52	3.67	12.51	
14	Capital Redemption Reserve	7.00	7.00	7.00	7.00	7.00	7.00	7.00	7.00	
15	Debenture Redemption Reserve	100.00	100.00	100.00	100.00	100.00	100.00	100.00	100.00	
16	Debt Service Coverage Ratio	2.02		2.04	1.64	2.05		2.06	1.35	
17	Interest Service Coverage Ratio	3.17		2.44	3.00	3.31		2.54	2.50	
18	Current Ratio	2.59		3.22	2.63	2.66		3.20	2.71	
19	Long Term Debt to Working Capital	3.25		4.14	2.98	3.07		3.83	2.83	
20	Bad Debt to Account Receivable ratio	-		-	-	-		-	0.08%	
21	Current Liability ratio	15.23%		9.56%	16.12%	15.41%		10.34%	16.20%	
22	Total Debt to Total Assets	52.84%		59.00%	51.90%	55.81%		61.01%	55.24%	
23	Debtors Turnover ratio	330.74		112.68	318.15	310.28		395.39	310.51	
24	Inventory Turnover ratio	4.44		1.01	3.90	4.62		4.49	4.23	
25	Operating Margin	7.82%		9.35%	6.87%	7.32%		7.31%	5.38%	
26	Net Profit Margin	5.91%		6.33%	7.30%	6.42%		6.51%	4.85%	

1. The above is an extract of the detailed format of Quarterly results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly financial results are available on the Stock Exchange Websites (www.bseindia.com and www.nseindia.com) and the Company's website www.trentlimited.com.

The above unaudited Standalone and Consolidated Financial Results for the Quarter ended 30th June 2023 were reviewed by the Audit Committee and recommended

- to the Board, which was thereafter taken on record by the Board of Directors of the Company at its meeting held on 09th August 2023 The exceptional item in the previous year in the consolidated financial results includes provisioning of Rs. 3 crores on account of uncertainty of utilisation of accumulated
- Goods and Services Tax (GST) credit in a downstream entity made during the quarter ended 31st March 2023. The results of the quarter ended 314 March 2023 are balancing figures between audited results in respect of full financial year and published year to date results up to
- 5. The statutory auditors of the company have carried out limited review of Standalone and Consolidated financial results for the current quarter and have issued an unmodified opinion.

third quarter of relevant financial year and have been subjected to limited review by the auditors.

For and on behalf of the Board of Directors

N.N.Tata Chairman

09th August, 2023

Mridul Gupta

Mumbai

DIN: 09781498

# ઝઘડિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ભવ્ય કાર્યક્રમો ચોજાયા

(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. તાલુકાના મુખ્ય મથકો ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ આદિવાસી દિન ઉજવણી સમિતિ દ્વારા પણ આદિવાસી દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા આદિવાસી દિન નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાનો પૂજન કરી ઉજવર્ણી કરી હતી.રાજૈપારડી નગરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ચાર રસ્તા ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાનું ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આજે ઠેરઠેર આદિવાસી દિવસની ઉજવણીનો માહોલ છવાયો છે.૯ મી ઓગસ્ટના દિવસને આપણે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ.વિશ્વ આદિવાસી દિવસનો મુળ હેતુ આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પર્યાવરણનું રક્ષણ કરવાનો રહ્યો છે.વર્ષ ૧૯૯૩ થી શરૂઆત થઈને દર વર્ષે ૯ મી ઓગસ્ટના દિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવાય છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે પ્રખર આદિવાસી જનનાયક બિરસા

Particulars

1 Total Income from Operations

extraordinary items) 3 Net Profit/ (Loss) for the period

or extraordinary items)

6 Equity Share Capital

Place: Ahmedabad

MANAPPURAM HOME

લેણદારો/ સહલેણદારોના

नाम अने दोन शामा

ઘનશ્યામ વિકલભાઈ પટેલ,

દયાબેન વિહલભાઈ પટેલ

/WAHME0003909/

/WAHME0000135/

ઝહીરહુસેન અશરફઅલી અન્સારી,

નફીસાબાનુ ઝહીરહુસેન અન્સારી,

ફઝલુરહેમાન અશરફઅલી અન્સારી

અમદાવાદ

અમદાવાદ

તારીખઃ ૧૦મી ઓગસ્ટ, ૨૦૨૩

તારીખ : ૯ ઓગસ્ટ, ૨૦૨૩

ક્શભઃ ગુજરાત

Date: 09-08-2023

Notes:

Net Profit/ (Loss) for the period

before tax, Exceptional and/ o

before tax, (after Exceptional

and/ or extraordinary items)

4 Net Profit/ Loss, for the period after tax, (After Exceptional and/

Total Comprehensive Income for

the period (Comprising profit/ loss for the period (after tax) and other

Comprehensive Incomé (after tax)

Reserve (excluding revaluation

Balance Sheet of szthe previous year

Earnings Per Share (EPS) (Face Value ₹10/- each) (For Continuing & Discontinuing Operations) Basic & Diluted



### રાજપારડી ચાર રસ્તા સર્કલ ખાતે ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું

મુંડાને ખાસ યાદ કરાય છે.બિરસા મુંડાનો જન્મ ૧૫ મી નવેમ્બર ૧૮૭૫ ના રોજ થયો હતો.બિરસા મુંડાને આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડા તરીકે યાદ કરે છે.તેઓ આદિવાસીઓના પ્રશ્નો બાબતે હંમેશ જાગૃત રહીને જીવનભર આદિવાસી સમાજના ગૌરવ અને રક્ષણ માટે કાર્યરત રહ્યા હતા.એક આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક તરીકે બિરસા મુંડાએ અંગ્રેજો સામે મોટો સંઘર્ષ કરીને આદિવાસીઓને ન્યાય અપાવ્યો હતો.આજરોજ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલકાના રાજપારડી ગામે ચાર રસ્તાં ખાતે આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે યોજાયેલ આદિવાસી

**DUTRON POLYMERS LIMITED** 

Registered Office: Dutron House, Nr. Mithakhali Underbridge, Navrangpura, Ahmedabad-380009.

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2023

Quarter Ended 30-06-2023

3.625.42

181.23

181.23

141.23

600.00

2.35

The above Financial Results which are published in accordance with Regulation 33 of the Securities and

Exchange Board of India (Listing Obligations & Disclosure Requirements), Regulations, 2015 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their

meeting held on August 9, 2023. The Financial Results are in accordance with the Indian Accounting Standards (Ind-AS) as prescribed under Section 133 of the Companies Act 2013 ("Act"), read with Rule 3

modification(s) / re-enactment(s) thereto). The Financial Results have been subjected to audit by the

3. Previous period's figures have been regrouped/rearranged to make them comparable with those of

of the Companes (Indian Accounting Standards) Rules, 2015 (including any amendment(s) /

Statutory Auditors of the Company, who have issued an unqualified opinion thereon.

4.435.27

193.52

193.52

145.52

145.52

600.00

દિવસની ઉજવણી અંતર્ગતના સમારોહમાં શાળાની બાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક બતાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત જન સમુદાયે રસભેર માણ્યો હતો.ઝઘડિયા ખાતેથી પસાર થયેલી રેલીમાં આદિવાસી સમાજના લોકો તેમના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી ઉપસ્થિત રહ્યા હતા અને હાથમાં ગર્વ ભેર તીર કામઠુ રાખી આદિવાસી સમાજના નાયકોએ સમાજના ઉત્થાન માટે

આપેલા બલિદાનનને યાદ કરી

ગર્વની લાગણી અનુભવી હતી.

## નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ



(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલ નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં રાજયકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર ની પ્રેરક

ઉપસ્થિતિમાં હાજરી આપી. આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ વેળાએ આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઇ મોદી એ વનબંધઓના સર્વાંગીણ વિકાસનો માર્ગ ગુજરાતના વનબંધુ વિકાસથી દેશને બતાવ્યો છે. આઝાદીનો અમૃતકાળ દેશના આદિવાસી સમાજ માર્ટે વિકાસનો અમૃતકાળ બનશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, કાર્યકર્તા મિત્રો,અગ્રણીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસવડા, પ્રયોજના વહીવટદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી, તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

## સ્વરાજ ટ્રેક્ટર્સે બેજોડ કાર્યક્ષમતા અને ટેક્નોલોજી સાથે ખેડૂતોને સશક્ત કરતાં 'સ્વરાજ ૮૨૦૦ વ્હીલ હાર્વેસ્ટર' રજૂ કર્યું

મોહાલી, દેશમાં ઝડપી વૃદ્ધિ સાધતી ટ્રેક્ટર બ્રાન્ડ અને મહિન્દ્રા ગ્રૂપનો હિસ્સો સ્વરાજ ટેક્ટર્સે આજે 'સ્વરોજ ૮૨૦૦ વ્હીલ હાર્વેસ્ટર' લોંચ કરવાની જાહેરાત કરી છે, જે બેસ્ટ-ઇન-ક્લાસ ઇંધણ કાર્યક્ષમતા અને ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીની દ્રષ્ટિએ

(₹In Lakhs)

Year Ended 31-03-2023

(Audited)

13,190.75

358.22

257.60

257.60

257.60

600.00

1.888.04

4.29

Quarter Ended

2,802.26

88.12

70.50

70.50

600.00

1.18

By Order of the Board

(R.H. Patel)

**Managing Director** 

માંગણા નોટિસ

મોકલવાની તારીખ

અને બાકી રકમ

૧૫-૦૫-૨૦૨૩

રૂા.પ,૧૨,૪૫૨/-

૧૫-૦૫-૨૦૨૩

રૂા.૧૨,૩૭,૪૮૯/

તારીખ

04-0*c* 

અદ્યકૃત અદ્યકારી

મણપ્પુરમ હોમ ફાઈનાન્સ લિમિટેડ

MANAPPURAM HOME FINANCE LIMITED

(અગાઉ મણખુરમ હોમ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ) CIN:U65923K12010PIC039179

**૨જીસ્ટર્ડ ઓફિસ:** આઇવી/૪૭૦ (જૂનો) ડબલ્યુ/૬૩૮એ (નવો) મનખુટમ હાઉસ, વાલાપડ થ્રિશુર, કેરાલા ૬૮૦૫૬૭ : મનખુટમ હોમ ફાઈનાન્સ લિમિટેડ, ત્રીજો માળ, ચુનિટ નં .૩૦૧થી ૩૧૫, એ વિંગ, કનકીયા વોલ સ્ટ્રીટ, અંઘેરી-કુર્લા રોડ, અંઘેરી ઇસ્ટ, મુંબઇ-૪૦૦૦૯૩, મહારાષ્ટ્ર, **ફોન નં.:** ૦૨૨-૬૬૨૧૧૦૦૦, **વેબસાઈટ: www.manappuramhomefin.com** 

કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

અને એન્કોર્સમેન્ટ ઑફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને કલમ (૨૦૦૨નો ૫૪) હેઠળ આપવામાં આવેલી સત્તાઓના ઉપયોગ હેઠળ

નીચે સહી કરનાર અધિકૃત અધિકારી છે. ૧૩(૧૨) સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ ૯ સાથે વાંચતા તેઓને **કબજા** 

**નોટિસ** જારી કરવામાં આવી હતી જેમાં ઋણ લેનારાઓ અને સહ-ઋણ લેનારાઓને નોટિસમાં ઉલ્લેખિત રકમ અને તેના પરના વ્યાજની સાથે

નોટિસ, તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવણી કરવા માટે જાણ કરવામાં આવી. છતાંય ઋણ લેનાર આ રકમ ચુકવવામાં નિષ્ફળ રહ્યા છે. આથી

ઋણ લેનાર અને સામાન્ય જનતાને નોટીસથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે કલમ ૧૩(૪) હેઠળ તેને/તેણીને આપવામાં આવેલી

સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે વર્ણવેલ મિલકતનો **સાંકેતિક** કબજો લીધો છે. જણાવેલ અધિનિયમ ઉપરોક્ત નિયમોના નિયમ ૯ સાથે વાંચતા.

ખાસ કરીને ઋણ લેનાર અને જાહેર જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે તેઓ આ મિલકત સાથે વ્યવહાર ન કરે અને મિલકત સાથેનો કોઈપણ વ્યવહાર મણપ્પુરમ હોમ ફાઇનાન્સ લિમિટેડના ચાર્જને આધીન રહેશે જે દરેક સંબંધિત મિલકતો માટે નીચે દર્શાવેલ છેઃ

સુરક્ષિત સંપત્તિનું વર્ણન

જેના સંદર્ભમાં રસ ઉભો કરવામાં આવ્યો છે

જી-૯, બીજો માળ, શિવ રેસિડેન્સી, શિલ્પા ૧ની

સામે , બાપા સિતારામ ચોક પાસે, નવા નરોડા, પોસ્ટ

ઓફિસ- ક્રિષ્નાનગર, અમદાવાદ, ગુજરાત, પિન-

ફ્લેટ નં.૩૦૪, બ્લોક નં.ઈ, ત્રીજો માળ, અમન

સિટી, સર્વે નં. ૭૩૧, ટી.પી.સ્ક્રીમ નં.૮૫, ફાઈનલ

પ્લોટ નં.૭૫, અમન સિટી, અમન રેસીડેન્સી-૨

સામે, વટવા, પોસ્ટ ઓફિસ- વટવા આઈ ઈ,

અમદાવાદ, ગુજરાત, પિન-૩૮૨૪૪૫

32238**4** 

જ્યારે, મ<mark>ારાખુરમ હોમ ફાઇનાન્સ લિમિટેડ (MAHOFIN)</mark> ના સિક્ચોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્ક્શન ઑફ ફાઇનાન્શિયલ એસેટસ

તેની અર્ગોનોમિક ડિઝાઇન આરામદાયક ડ્રાઇવિંગ તથા કામના લાંબા કલાકોમાં ઓછો થાક અનુભવાય તે સુનિશ્ચિત કરે છે. વધુમાં એક સમર્પિત રિલેશનશીય મેનેજર અને એપ-આધારિત વિડિયો કોલિંગ દ્વારા ઓપરેટર્સ પર્સનલાઇઝ્ડ સપોર્ટ મેળવે છે, જે ઘરઆંગણે ઝડપી અને અનુકૂળ સેવા સુનિશ્ચિત કરે છે.

એમએન્ડએમ લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડેન્ટ હેમંત સિક્કાએ કહ્યું હતું કે, ''સ્વરાજ ૮૨૦૦ વ્હીલ હાર્વે સ્ટરની રજૂઆત ફાર્મ મશીનરી ઉપર અમારા વ્યૂહાત્મક ધ્યાન આપવા તથા આ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિને બળ આપવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. આ ઇન્ટેલિજન્ટ મશીનરી કૃષિના આધુનિકીકરણ અને ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી સાથે સક્ષમ બેનાવવા માટેના

ઘણાં પ્રથમ અદ્યતન સુવિધાઓ ધરાવે છે. અમારા અતૂટ સમર્પણનો પુરાવો છે.'' એમએન્ડએમના ઁ સ્વરાજ ડિવિઝનના સીઇઓ હરિશ ચવાણે કહ્યું હતું કે, "અમારા ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના ટ્રાન્સફોર્મ ફાર્મિંગ અને એનરિચ લાઇવ્સના ઉદ્દેશ્યને અનુરૂપ મહત્તમ ઉપજ અને નફો હાંસલ કરવા શ્રેષ્ઠ મિકેનાઇઝ્ડ સોલ્યુશન્સ દ્વારા ખેડૂતોને સશક્ત કરવા પ્રતિબદ્ધ છે. સ્વરાજ ૮૨૦૦ વ્હીલ હાર્વેસ્ટર એ ગ્રાહક કેન્દ્રિતતા, આધુનિક ખેતી પદ્ધતિઓ અને ટકાઉ ખેતી માટેના અમારા સમર્પણનો પુરાવો છે.'' સ્વરાજ ૮૨૦૦ વ્હીલ હાર્વેસ્ટર સ્વરાજના દેશભરમાં વિશાળ ડીલર નેટવર્ક દ્વારા ઉપલબ્ધ બનશે. સ્વરાજ સમર્પિત સેલ્સ અને સર્વિસ ટીમની સાથે-સાથે વ્યૂહાત્મક કેન્દ્રો અને સર્વિસ વેન દ્વારા સમગ્ર ભારતમાં મજબૂત હાર્વે સ્ટર ડીલર નેટવર્કનો લાભ ઉઠાવે છે.

#### પશ્ચિમ રેલવે – અમદાવાદ ડિવિઝન <u>ઈ-ઓક્શન આમંત્રિત સૂચના</u> ઓક્શન કેટલોગ નં. કેટલોગ પહેલે થી <u>તા.02/08/2023 ના 16:43</u> કલાકે Pay-Use-ADI-23 IREPS પર પ્રકાશિત થયેલ દ કોન્ટાક્ટ લોટ નં./કેટેગરી PnU-ADI-SID 18-08-202 **સિધ્ધપુર રેલવે સ્ટેશન** ખાતે પે એન્ડ યુઝ 13:00-ાાધારે નોન-ડિલક્ષ ટાઈપ ટોયલેટ્સ ના સંર ટોયલેટ્સ) મને જાળવણીના વ્યવસ્થાપન માટેનો કોન્ટ્રાક્ટ PnU-ADI-UJA Toi-6-22-2 ત્રણ વર્ષના સમયગાળા માટે અમદાવાદ ડિવિઝનન 18-08-2023 03 વર્ષ **ઊંઝા રેલવે સ્ટેશન** ખાતે પે એન્ડ યુઝ ના આધારે 13:00-13:40 કલાકે (પે એન્ડ યુઝ નોન-ડિલક્ષ ટાઈપ ટોયલેટસ ના સંચાલન જાળવણીના વ્યવસ્થાપન માટેનો કોન્ટ્રાક્ટ PnU-ADI-PTN-Toi-4-22-2 18-08-2023 13:00-13:50 કલાકે ત્રણ વર્ષના સમયગાળા માટે અમદાવાદ ડિવિઝનના 03 વર્ષ . **પાટણ રેલવે સ્ટેશન** ખાતે પે એન્ડ યુઝ ના આધારે (પે એન્ડ યુઝ ટોયલેટ્સ) નોન-ડિલક્ષ ટાઈપ ટોયલેટસ ના સંચાલન જાળવણીના વ્યવસ્થાપન માટેનો કોન્ટ્રાક્ટ. 18-08-2023 13:00-14:00 કલાકે ત્રણ વર્ષના સમયગાળા માટે અમદાવાદ ડિવિઝનના PnU-ADI-VG 03 વર્ષ Toi-ADI-VG Toi-3-22-2 (પે એન્ડ યુઝ -ટોયલેટ્સ) આધારે નોન-ડિલક્ષ ટાઈપ ટોયલેટસ ના સંચાલ• બને જાળવણીના વ્યવસ્થાપન માટેનો કોન્ટાક્ટ**.** 03 av -Toi-9-22-2 ન્યુ ભુજ રેલવે સ્ટેશન (સ્ટેશન બિલ્ડીંગની 13:00-**અંદર)** ખાતે પે એન્ડ યુઝ ના આધારે નોન-ડિલક્ષ ટાઈપ ટોયલેટસ ના સંચાલન અને જાળવણીન વ્યવસ્થાપન માટેનો કોન્ટાક્ટ. PnU-ADI-MAN -Toi-10-22-2 ત્રણ વર્ષના સમયગાળા માટે અમદાવાદ ડિવિઝનના 18-08-2023 13:00-03 વર્ષ મ**ાગીનગર રેલવે સ્ટેશન** ખાતે પે એન્ડ યુઝ (પે એન્ડ યુઝ 14:20 કલાકે આધારે નોન-ડિલક્ષ ટાઈપ ટોયલેટસ ના સંચાલન બને જાળવણીના વ્યવસ્થાપન માટેનો કોન્ટાક્ટ**.** ત્રણ વર્ષના સમયગાળા માટે અમદાવાદ ડિવિઝનના PnU-ADI-NRD 18-08-2023 03 વર્ષ 13:00-14:40 કલાકે નરોડા રેલવે સ્ટેશન બિલ્ડીંગની પાછળના (પે એન્ડ યુઝ **સર્કયુલેટીંગ વિસ્તાર** ખાતે પે એન્ડ યુઝ ના આધારે નોન-ડિલક્ષ ટાઈપ ટોયલેટ્સ ના સંચાલન અ જાળવણીના વ્યવસ્થાપન માટેનો કોન્ટ્રાક્ટ. AA/9 ત્રણ વર્ષના સમયગાળા માટે અમદાવાદ ડિવિઝનના 18-08-2023 13:00-14:50 કલાકે PnU-ADI-KLL **કલોલ રેલવે સ્ટેશન** ખાતે પે એન્ડ યુઝ ના આધારે (પે એન્ડ યુઝ નોન-ડિલક્ષ ટાઈપ ટોયલેટ્સ ના સંચાલન ટોયલેટ્સ) જાળવણીના વ્યવસ્થાપન માટેનો કોન્ટ્રાક્ટ.

# અમને લાશક કરોઃ 🚹 facebook.com/WesternRly∙ અમને ફોલો કરોઃ 🚩 twitter.com/WesternRly

અનું. નં.	ટેન્ડર નં.	કામનું નામ	અંદાજીત ખર્ચ	અર્નેસ્ટ મન			
01	ઈએલ-50-1-એડીઆઈ- ટી-42-2023-24R	સાબરમતી B - SBIB ખાતે ટ્રેન જાળવણી માટે જરૂરી વધારાના C&W	₹ 16,52,524/-	₹ 33,100/			
આવ	શ્યક્તાઓના સંબંધમાં ઈલેક્ટ્રિકલ	ા કાર્ય.					
02	ઈએલ-50-1-એડીઆઈ- ટી-68-2023-24	ડિઝલ શેડ વટવા માં ઈલેક્ટ્રિકલ લોકોમોટીવ્સ માટે જાળવણી સુવિધાઓ/	₹ 26,36,140/-	₹ 52,700/			
M&I	P ની બનાવટના સંબંધમાં ઈલેક્ત્રિ						
03		2 વર્ષના સમયગાળા માટે અમદાવાદ સ્ટેશનના મણીનગર બાજુ બે લિફ્ટ્સ		₹ 11,300/			
(પ્લેટ	ટફોર્મ 2/3 અને પ્લેટફોર્મ 6/7)	નું વાર્ષિક વ્યાપક જાળવણી કોન્ટ્રાક્ટ.					
04	ઈએલ-50-1-એડીઆઈ- ટી-13-2023-24R	અમદાવાદ ડિવિઝન :- અમદાવાદ ડિવિઝનના કોચિંગ ડેપોમાં લેઈંગ ખામીયુક્ત	₹ 22,74,834/-	₹ 45,500/			
આઉ	ટપુટ 110 V DC, ક્ષમતા - 50	(RBC- IGBT આધારીત ઈનપુટ સપ્લાય ) Amps) નું રિપેરીંગ/રિકન્ડિશનીંગ)		50 Hz અને			
05	ઈએલ-50-1-એડીઆઈ- ટી-39-2023-24R	અમદાવાદ ડિવિઝન : અમદાવાદ ડિવિઝન ટ્રેનોના LHB કોચોના સ્વિચબોર્ડ કેબિનેટમાં	₹ 26,85,202/-	₹ 53,700/			
પાણીના પ્રવેશને રોકવા માટે ડ્રેઈનની વ્યવસ્થા સાથે SS Tray ની આપૂર્તિ અને ફિક્સિંગ.							

નામ બદલેલ છે

# અરવલ્લી -સાબરકાંઠામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે માનવમહેરામણ ઉમટ્યું

હતું. તેના અનુસંધાને આ દિવસની ઉજવેણી કરવામાં સમુદાયે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

(પ્રતિનિધિ)મોડાસા, આવે છે. અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્ત અદિવાસી દિવસની ઉજવણી મણિપુરમાં બે આદિવાસી વિશ્વના ૧૯૨ દેશોમાં આ દિવસની ઉજવણી વિશ્વના દીકરીઓને નગ્ન કરી જાહેરમાં પરેંડ કરાવી સામુહિક આદિવાસી સમુદાયની સંસ્કૃતિ, રીત રીવાજો, બળાત્કારની બનેલ ઘટના, મધ્યપ્રદેશમાં આદિવાસી બોલી,શિક્ષા, સ્વાસ્થ્ય તેમજ તેમના પર થતા વ્યક્તિ ઉપર પેશાબ કરનાર અને ગુજરાત માં ચાર વર્ષની અત્યાચારો અટકાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ ચિંતિત | દીકરી પર બળાત્કારની ઘટના વગેરે યાદ કરી સમગ્ર

### PROMACT IMPEX LIMITED

(Formerly known as PROMACT PLASTICS LIMITED) [CIN: L25200GJ1985PLC007746]

Regd. Office: 12th Floor-1201, City Center-2, B/S Heer Party Plot, Nr. Shukan Mall Cross Road, Science City Road, Sola, Ahmedabad 380 060

EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2023

(Rs. In Lakh)

PARTICULARS	Quarter ended on 30-06-2023 (Unaudited)	Quarter ended on 30-06-2022 (Unaudited)	Year ended on 31-03-2023 (Audited)
Total income from operations (Net)	28.96	3.85	158.91
Net Profit / (Loss) for the period (before Tax,			
Exceptional and/or Extraordinary items)	2.70	(19.12)	55.29
Net Profit / (Loss) for the period before tax			
(after Exceptional and/or Extraordinary items)	2.70	(19.12)	55.29
Net Profit / (Loss) for the period after tax (after			
Exceptional and/or Extraordinary items)	2.70	(19.12)	52.04
Total Comprehensive Income for the period	2.70	(19.12)	52.04
Equity Share Capital	651.18	651.18	651.18
Reserves (excluding Revaluation Reserves)			(936.57)
Earnings Per Share (after extraordinary items)			
(Face value of Rs. 10/- each) (for continuing			
and discontinued operations)			
Basic:	0.04	(0.29)	0.80
Diluted:	0.04	(0.29)	0.80

### NOTES:

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.
- The full format of Quarterly Financial Results are available on the website of BSE Limited at www.bseindia.com

For PROMACT IMPEX LIMITED ANKIT J. PATEL MANAGING DIRECTOR

Date: 9th August, 2023 Place: Ahmedabad

(DIN: 02351167)

### અર્ચિત ઓર્ગેનોસિસ લિમિટેડ

૨જી. ઓફિસઃ પ્લોટ નં. ૨૫/૯-એ, ફેઝ-Ⅲ, જી.આઈ.ડી.સી. નરોડા, અમદાવાદ-૩૮૨૩૩૦. ફોન ઃ 079-40082447 E-Mail: share@architorg.com Website: www.architorg.com CIN: L24110GJ1993PLC019941

આથી નોટીસ આપવામાં આવે છે કે અર્ચિત ઓર્ગેનોસિસ લિમિટેડના સભાસદોની 30મી વાર્ષિક સાધારણ સભા **('એજીએમ')** કોર્પોરેટ અફેર્સ મંત્રાલથ (એમસીએ) દ્વારા તા. ૮ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ જારી કરાથેલ સરક્યુલર નં. ૧૪ / ૨૦૨૦, તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ જારી કરાયેલ સરક્યુલર નં. ૧७/૨૦૨૦, તા. ૫ મે, ૨૦૨૦ ના રોજ જારી કરાયેલ સરક્યુલર નં. ૨૦/૨૦૨૦, તા. ૧૫ જૂન, ૨૦૨૦ ના રોજ જારી કરાયેલ જનરલ સરકર્યુલર નં. ૨૨/૨૦૨૦, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ જારી કરાર્થેલ જનરલ સરક્યુલર નં. ૩૩/૨૦૨૦, તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ જારી કરાચેલ જનરલ સરક્યુલર નં. ૩૯/૨૦૨૦, તા. ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ જારી કરાચેલ સરક્યુલર નં. ૦૨/૨૦૨૧, તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ જારી કરાચેલ સરક્યુલર નં. ૨૧/ ૨૦૨૧, તા. પં મે, ૨૦૨૨ ના રોજ જારી કરાચેલ સરક્યુલર નં. ૦૨/ ૨૦૨૨ અને તા. ૨૮ કિસેમ્બર ૨૦૨૨ ના રોજ જારી કરાયેલ સરક્યુલર નં. ૧૦/૨૦૨૨ ના સરક્યુલર વાંચતા તેમજ સેબી દ્વારા તા. ૦૫ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ જારી કરાયેલ સરક્યુલર નં. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 અને બીજા અન્ય જારી કરાયેલ સરક્યુલર સાથે વાંયતા (બંધાને સંયુક્ત રીતે સરક્યુલર ગણવું) અને તેને અનુસરતા વિકિયો કોન્ફરન્સીંગ ('વીસી') / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો ('ઓએવીએમ') મારફતે કંપનીને તેના સભાસદોને સભાના સ્થળ ઉપર પ્રત્યક્ષ હાજર રહ્યા વગર, એજીએમ નોટીસમાં જણાવેલ કામકાજોની બહાલી માટે ગુરૂવાર, તારીખ ૩૧ ઓગસ્ટ,

૨૦૨૩ ના રોજ બપોરના ૧૨.૩૦ કલાકે ચોજવામાં આવશે. ઉપરોક્ત જારી કરેલ સરક્યુલરની પૂર્તતા કરતા કંપનીની ૩૦મી એજીએમ ની નોટીસ અને નાણાંકીય વર્ષ ૨૦૨૨–૨૩ ના વાર્ષિક અહેવાલોને ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા બધાજ સભાસદોને કે જેઓએ તેમના ઈ-મેઈલ આઈડી કંપની /ડિપોઝીટરીઓ પાસે નોંધાયેલા છે તેમને મોકલી આપવામાં આવ્યા છે. આ ૩૦મી એજીએમ અને અને નાણાંકીય વર્ષ ૨૦૨૨–૨૩ ના વાર્ષિક અફેવાલોને કંપનીની વેબસાઈટ <u>www.architorg.com</u> અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com અને એજીએમ નોટીસ નેશનલ સિક્ચોરીટીઝ ડિપોઝીટરીઝ લિમિટેડ (એનએસડીએલ) ની વેબસાઈટ <u>https://www.evoting.nsdl.com</u> ઉપર ઉપલબ્ધ છે.

કંપની ધારા ૨૦૧૩ની કલમ ૧૦૮ અને તેને સંબંધિત કાયદાઓ દેઠળ સમય–સમય પર સુધારો કરીને અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને કિસ્કલોઝર રીકવાચરમેન્ટ્સ) રેગ્યુલેશન, ૨૦૧૫ ના રેગ્યુલેશન ૪૪ મુજબ વાર્ષિક સામાન્ય સભાની નોટીસમાં જેણાવ્યા પ્રમાણેના ઠરાવો માટે સભ્યોને પોતાના મત આપવા માટે રીમોટ ઈ–વોટીંગની સુવિધા પૂરી પાંડવામાં આવેલ છે. કંપની દ્વારા એનએસડીએલને તેમના બધા સભાસદોને ઈ–વોટીંગની સુવિધા પૂરી પાડવા માટે અધિકૃત એજન્સી તરીકે નિયુક્ત કરેલ છે.

ઈ–વોટીંગ દ્વારા મત આપવા લાયક કરવા માટેની **તારીખ ગુરૂવાર ૨૪ ઓગસ્ટ, ૨૦૨**૩ (Cut-off Date) રહેશે. રીમોટ ઈ–વોટીંગનો સમય દરેક સભાસદો કે જે ભૌતિક સ્વરૂપમાં કે કિમેટ સ્વરૂપમાં શેર ઘરાવતા હશે તેઓ માટે ૩ દિવસ માટે ખુલો રહેશે. તે **તારીખ સોમવાર ૨૮ ઓગસ્ટ, ૨૦૨૩** ના રોજ સવારે ૧૦.૦૦ વાંગ્યાથી શરૂ થશે અને **તારીખ બુધવાર ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩** ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે પૂરો થશે. ત્યારબાદ રીમોટ ઈ-વોટીંગ સુવિધા ઉપલબ્ધ થશે નહીં. કંપનીના જે સભાસદોએ રીમોટ ઈ-વોટીંગ દ્વારા ઠરાવો ઉપર વોટીંગ ન કર્યુ હોય તેવા સભાસદો વીસી 🦯 ઓએવીએમ દ્વારા યોજાનાર એજીએમ સભામાં ઉપસ્થિત રહેનારા સભાસદો સભા વખતે મતદાન કરી શકશે.

જે સભાસદોએ સભા પહેલા રીમોટ ઈ–વોટીંગ દ્વારા મતદાન કરી દીધું હશે તેઓ પણ સભામાં હાજર રહી શકશે. પરંતુ ફરીથી તેઓનો મત આપી શકશે નહીં. રીમોટ ઈ–વોટીંગની સુવિધા અને એજીએમમાં વોટીંગની સુવિધા વિશેની વિગતવાર માહિતી એજીએમ નોટીંસમાં આપવામાં આવેલ છે. કોઈપણ વ્યક્તિ જે આ નોટીસ મોકલ્યાની તારીખ પછી કંપનીના શેર ધારક બનેલ હોય અને કટ—ઓફ–કેટ સુધી શેર ધારણ કરેલ હોય તેઓ એજીએમ નોટીસમાં જણાવેલ માહિતી અને પ્રક્રીયાને અનુસરીને ઈ–વોટીંગ દ્રારા પોતાનો મત આપી શકશે. જે સભાસદોના ઈ–મેઈલ આઈડી કંપની કે કિપોઝીટરીઝ પાસે નોંધાયેલ ન હોય તેવા સભાસદો માટે ઈ–વોટીંગ કરવા માટે લોગ–ઈન ની પ્રક્રીયા.

- જે સભાસદો તેમના શેર ભૌતિક સ્વરૂપમાં ધારણ કરતા હોચ તેમણે તેમના લોગ-ઈન માટે <u>share@architorg.com</u> ઉપર જરૂરી વિગતો જેવીકે, ફોલીચો નંબર, સભાસદનું નામ અને સેલ્ફ એટેસ્ટેડ પાન કાર્ડ અને આધાર કાર્ડની કોપી સહીત ઈ–મેઈલ મોકલવો.
- જે સભાસદો તેમના શેર ડીમેટમાં ધારણ કરતા હોય તેઓ તેમના લોગ-ઈન માટે <u>share@architorg.com</u> ઉપર જરૂરી વિગતો જેવીકે, ડીમેટ એકાઉન્ટની વિગતો, સભાસદનું નામ, કલાયન્ટ માસ્ટર, સેલ્ફ એટેસ્ટેડ પાન કાર્ડ અને આધાર કાર્ડની કોપી સહીત ઈ–મેઈલ મોકલવો.
- અન્યથા શેર ધારણ કરનાર સભાસદો તેમની ઉપરોક્ત જણાવેલ દસ્તાવેજો સહિતની વિગતો <u>evoting@nsdl.co.in</u> ઉપર મોકલી ઈ-વોટીંગ માટે યુઝર આઈડી અને પાસવર્ડ મંગાવી શકે છે.

આથી જે સભાસદોના ઈમેઈલ આઈડી કંપની / આરટીએ પાસે નોંધાયેલા નથી. તેઓ કંપની પાસેથી ઈ–કોમ્યુનિકેશન મેળવીને તેમજ નીયે જણાવેલ પ્રક્રીયા અનુસરીને તેમના ઈમેઈલ આઈડી નોંધાવી લેવા વિનંતી.

- જે સભાસદો તેમના શેર ભૌતિક સ્વરૂપમાં ધારણ કરતા हોય તેમણે તેમના ઈમેઈલ આઈડી નોંધાવવા <u>share@architorg.com</u> ઉપર જરૂરી વિગતો જેવીકે, કોલીચો નંબર, સભાસદનં નામ અને સેલ્ક એટેસ્ટેડ પાન કાર્ડ અને આધાર કાર્ડની કોપી સહીત ઈમેઇલ મોકલવો.
- જે સભાસદો તેમના શેર ડીમેટમાં ધારણ કરતા હોય તેમણે તેમનો ઈમેઈલ આઈડી નોંધાવવા તેમના ડિપોઝીટરી પાર્ટીસીપન્ટનો સંપર્ક કરવો.

સભાસદોને ઈ–વોટીંગને લગતી કોઈ પુછપરછ અથવા સમસ્યાઓ કે ફરિયાદો હોય તો તેઓ વેબસાઈટwww.evoting.nsdl.com પર ઉપલબ્ધ ''ફ્રીક્વન્ટલી આસ્કડ ક્વેશ્ચન્સ'' ("FAQs") જોઈ શકે છે અને ઈ–વોટીંગ મેન્યુલ વાંચી શકે છે અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦૧૦૨૦૯૯૦ અને ૧૮૦૦૨૨૪૪૩૦ અથવા શ્રી પલ્લવી મ્હાતે ને <u>evoting@nsdl.co.in</u> ઉપર મોકલી ઈ–મેઈલ મોકલી શકે છે.

ડિવિડન્ડની ચૂકવણી અને દેક્ષ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ)

(ટીડીએસ) નીચે મુજબ કાપવાને આધિન રહેશે.

બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા તારીખ ૧૨ મે, ૨૦૨૩ ના રોજ યોજાયેલ સભામાં નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૩ માટે ઈક્વિટી શેર દીઠ રૂા. ૦.૫૦ નું ડિવિડન્ડ (રૂા. ૧૦/– ના એક એવા) ની ભલામણ કે જે કંપનીની વાર્ષિક સાધારણ સભા દરમ્યાન સભાસદોની મંજૂરીને આધિન રહેશે. કંપનીના સભાસદોનું રજીસ્ટર અને શેર ટ્રાન્સફર બુક બુધવાર ૦૯ ઓગસ્ટ, ૨૦૨૩ થી તારીખ મંગળવાર ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં (બન્ને દિવસો સહિત) બંધ રહેશે. સભાસદો દ્વારા એજીએમમાં જાહેર કરાયેલ કિવિકન્ડ જ્યાં લાગુ પડતુ હશે તેના ઉપર ઈન્કમ ટેક્ષ કિડકટેડ એટ સોર્સ

१. मंगणपार ता. ०८ ओगस्ट, २०२३ ना हिपसने अंते नेशनल सिड्योरीटीઝ डिपोઝीटरीઝ લિમિटेड अने सेन्ट्रल डिपोઝीटरीઝ सर्पिसीस (ઈન્ડીયા) લિમિટેડ દ્વારા જારી કરાયેલ પત્રક મુજબ શેરને ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં ધારણ કરતા બધા જ લાભકર્તા ધારકોને.

૨. બધાજ સબાસદો કે જેઓ ભૌતિક સ્વરૂપમાં શેર ધારણ કરે છે અને તેઓ દ્વારા માન્ય ટ્રાન્સમિશન અને ટ્રાન્સપોઝીશન ની માન્ય વિનંતિ કંપની / શેર ટ્રાન્સફર રજીસ્ટ્રાર પાસે મંગળવાર તા. ૦૮ ઓગસ્ટ, ૨૦૨૩ ના દિવસને અંત સુધીમાં નોંધાવી હોય.

નાણાંકીચ કાયદો ૨૦૨૦ માં દાખલ કરાયેલ સુધારા પ્રમાણે કંપની દ્વારા શેર ધારકોને તારીખ ૧ એપ્રિલ, ૨૦૨૦ પછી ચૂકવવામાં આવેલ ડિવિડન્ડ ઉપર નક્કી કરેલ દરે ટેક્ષ કિક્કશન એટ સોર્સ કાપવાનો રહેશે. આ ટીકીએસની જરૂરી પૂર્તતા માટે સભાસદોને વિનંતી કે તેઓ તેમનું રેસીકેન્શીયલ સ્ટેટસ, પાન અને તેમની આઈટી કાયદા મુજબની કેટેગરી વિગેરે જો ડીમેટમાં શેર ધરાવતા હોય તો કિપોઝીટરીઝ પાર્ટીશીપન્ટ પાસે અપકેટ કરાવવાની રહેશે અને જો ભૌતિક સ્વરૂપમાં શેર ધારણ કરતા હશો તો ઉપરોક્ત માહિતી કંપની / આરટીએ પાસે તેના નામ અને ફોલીચો નંબર જણાવી અપડેટ કરાવવાની રહેશે. નોન–ડિકકશન ઓફ ટેક્ષનો લાભ લેવા શેર ધારકોને વિનંતિ કે તેઓ તેમના જરૂરી દસ્તાવેજો 🖊 ડિક્લેરેશન ફોર્મ ઈ—મેઈલ દ્વારા તારીખ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૩ પહેલા <u>share@architorg.com</u> ઉપર મોકલી આપે.

જો સભાસદ દ્વારા એજીએમમાં મંજૂરી મળશે તો ડિવિડન્ડને ઈલેક્ટ્રોનીકલી દ્વારા મેળવવા માટે નીચે જણાવેલ વિગતો જમા કરાવવી

કંપનીને આપની સહી કરેલ લેટર મોકલો જેમાં જણાવો : ૧. આપને બેંકના જે ખાતામાં કિવિકન્કની રકમ જોઈતી હોય તેનું નામ અને શાખા. શેર ઘરાવતા ૨. બેંકના ખાતાનો પ્રકાર. હોય તો 3. બેંક ખાતા નંબર, MICR કોડ, IFSC કોડ.

૪. પહેલા શેર ધારકનું નામ હોય તેવા કેન્સલ કરેલ ચેકની કોપી. જો ડીમેટમાં શેર ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ (ડીપી) નો સંપર્ક કરી આપના ડિમેટ એકાઉન્ટમાં ઈ–મેઈલ અને બેંક એકાઉન્ટની વિગતો ની નોંધણી આપના ડીપી ના માર્ગદર્શન દ્વારા કરાવો.

વતી, **અર્ચિત ઓર્ગેનોસિસ લિમિટેડ** તારીખ : ૯ ઓગસ્ટ, ૨૦૨૩ સ**હી / - કંદર્પ કે. અમિન** ચેરમેન અને હોલ ટાઈમ ડાયરેક્ટર (DIN : 00038972) સ્થળ : અમદાવાદ

### બ્લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

CIN: L17100DN1985PLC005561 રજુ ઓફિસ : પ્લોટ નં. દર-બી, દાનુયુગ સહકારી સંઘ લી. ગામ પીપરીયા, સીલવાસા, યુ.ટી. દાદરા અને નગર હવેલી-૩૯૬૨૩૦, કોર્પોરેટ ઓફીસ : ઓફીસ નંબર-૧પ/૧૭, પહેલો માળ, મેકર ચેમ્બર્સ ૩, જમનાલાલ બજાજ રોડ, નરીમન પોઈન્ટ, મુંબઈ-૪૦૦૦૨૧. છમેછલ આઇડી : bluechiptex@gmail.com, વેબસાઇટ : www.bluechiptexindustrieslimited.com ટેલીફોન નં. ૦૨૨-૪૩પ૩૦૪૦૦ ૩૦મી જુન ૨૦૨૩ના રોજ પૂરા થતા ત્રીમાસિક ગાળાનુ અનઓડિટેડ નાંણાકીય પરિણામો

રૂપા ૧૯૦૩ કર્યા કર્યા સામાના કર્યા કરાયા કર્યા કરમા કર્યા કરમા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરમા કર્યા કરમા કર્યા કર્યા કરમા કર્યા કરમા કરમા કરમા કરમા કરમા કર્યા કરમા કરમા કરમા કરમા કરમા કરમા કરમા કરમ									
વિગતો	ત્રીમાસિક અંતે ૩૦.૦૬.૨૦૨૩ સમીક્ષા કરી	ગ્રીમાસિક અંતે ૩૧.૦૩.૨૦૨૩ ઓડીટેડ	ત્રીમાસિક અંતે ૩૦.૦૬.૨૦૨૨ સમીક્ષા કરી	વર્ષના અંતે ૩૧.૦૩.૨૦૨૩ ઓડીટેડ					
કામગીરીમાંથી કુલ આવક	<b>६,१२</b> 3.0२	૫,૮૮૨.૮૯	६,७०४.१७	૨૫,૨૭૨.૪૦					
ચોખ્ખો નફો / (નુકસાન) કર બાદ	<b>૩</b> ૬.૨૨	इ.८७	₹.૯૫	૯૧.૨૦					
સમયગાળા માટે કુલ વ્યાપક આવક	33.20	૧૦.૨૭	૭.૫૦	૯૩.૩०					
ઇક્વિટી શેરની મૂડી	૧૯૭.૦૫	૧૯૭.૦૫	૧૯૭.૦૫	૧૯૭.૦૫					
અન્ય ઇક્વિટી	-	-	-	ર,પ૭૫.૬૨					
શેર દીઠ આવક (દરેક રૂ.૧૦/- ની મૂળ કિંમત)									
મૂળભૂત અને પાતળું	٩.८४	૦.૩૫	૦.૩૫	8.83					

- ૩૦મી જૂન, ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના ઉપરોક્ત પરિણામોની ઓડિટ સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. અને ૯મી ઓગેસ્ટ, ૨૦૨૩ ના રોજ યોજાયેલી તેમની મીટિંગમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને તે કંપનીના વૈધાનિક ઓડિટર્સ દ્વારા મુર્યાદિત સમીક્ષાને આધિન હતું.
- અગાઉના સમયગાળા માટેના આંકડાઓને તુલનાત્મક બનાવવા માટે જરૂરી હોય ત્યાં ફરીથી જૂથબદ્ધ/પુનઃવર્ગીકૃત કરવામાં આવે છે. ઉપરોક્ત સ્ટોક સાથે ફાઇલ કરાયેલ ત્રિમાસિક નાણાકીય પરિણામોના વિગતવાર ફોર્મેટનો અર્ક છે SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ હિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ) રેગ્યુલેશનના રેગ્યુલેશન ૩૩ હેઠળ એક્સચેન્જ, ૨૦૧૫. ત્રિમાસિક નાણાકીય પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટ સ્ટોક એક્સચેન્જની www.bseindia.com પર અને કંપનીની વેબસાઇટ www.bluechiptexindustrieslimited.com પર પણ. વેબસાઇટ પર ઉપલબ્ધ છે બોર્ડ ઓક ડાયરેક્ટર વતી

સહી/-, રાહુલ એન. ખેમાની સીએફઓ એન્ડ ડાયરેક્ટર

### મેં મારું નામ **બારોટ ખુશી** કોશિકભાઇ હતું, જે બદલીને પટેલ ખુશી માર્મિક કરેલ છે.

જેની નોંધ લેવી. સરનામું : ૨૧૫, પટેલ વાસ, નાંદોલ, ગાંધીનગર-૩૮૨૩૦૫

### લેસ્ટર્ન ટાઇસ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર



ક્થળ : મુંબઈ

તા. ૯મી ઓગસ્ટ. ૨૦૨૩

## યુનીફોસ એન્ટરપ્રાઈસીઝ લીમીટેડ

CIN:L24219GJ1969PLC001588

રજી.ઓફિસઃ ૧૧, જી.આઈ.ડી.સી., વાપી, જિલ્લોઃ વલસાડ - ૩૯૬ ૧૯૫, ગુજરાત 

૩૦માં જૂન, ૨૦૨૩ ના રાજ પુરા થયલા (ત્રમાસિક ગ	ाणा माटना अनआ।	ડટડ નાણાકાય પરાઇ	IIHI	(३.साजमा)
		વર્ષના અંતે		
વિગતો	30.05.2023	39.03.2023	30.05.2022	39.03.2023
	અનઓડીટેડ	ઓડીટેડ	અનઓડીટેડ	ઓડીટેડ
કામગીરીમાંથી કુલ આવક	_	_	_	૧૪૭.૧૯
કર અને અસાધારણ વસ્તુઓ પહેલાના સમયગાળા માટે ચોખ્ખો નફો / (નુકશાન)	(٤.૪૩)	96.66	૧૨.૭૮	૩,૯૬૨.૧૩
કર બાદના સમયગાળા માટે ચોખ્ખો નફો / (નુકશાન)	(58.5)	85.56	૧૨.૭૮	૩,૯૨૨.૫૪
સમયગાળા માટે કુલ વ્યાપક આવક (કર બાદ) અને અન્ય વ્યાપક આવક (કર બાદ)	(૧૦,૫૭૭.૯૫)	૩૨૬.૫૦	(४८,१૯७.२उ)	(૧૪,૩૬૩.૮૨)
ઈકિવટી શેર કેપિટલ	૧,૩૯૦.૯૨	૧,૩૯૦.૯૨	૧,૩૯૦.૯૨	૧,૩૯૦.૯૨
<b>શેર દીઠ કમાણી (રૂ .૨/– ના દરેક)</b> મૂળભૂત અને મંદપડેલુ (શેર દીઠ રૂ.) (વાર્ષિક નહીં)	(0.01)	0.09	0.03	૫.૬૪

કંપરોકૃત એકસટ્રેક્ટ ફોરમેટ કે જે ૩૦મી જૂન, ૨૦૨૩ ના રોજ પુરા થયેલા ત્રિમાસીક ગાળાના અનઓડિટેડ નાણાંકીય પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટનું છે, જે રેગ્યુલેશન ૩૩ના સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ ડીસ્કલોઝર રીકવોયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, રેગ્૧પ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાઈલ કરવામાં આવ્યું છે. ૩૦મી જૂન, ૨૦૨૩ ના રોજ પુરા થયેલા ત્રિમાસીક ગાળાના અનઓડિટેડ નાણાંકીય પરિણામોનું સંપૂષ્ કોર્મેટ કંપનીની વેબસાઈટ www.uelonline.com પર તેમજ જયાં કંપનીના ઈક્લીટી શેરો લીસ્ટેડ થયેલા છે એવા સ્ટોક એક્સચેન્જો, એટલેકે, બીએસઈ લીમીટેડ (બીએસઈ)ની વેબસાઈટ www.bseindia.com તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ. (એનએસઈ)ની વેબસાઈટwww.nseindia.com પર ઉપલબ્ઘ છે.

ર્તોંઘઃ ઓડિટ સમિતિ દ્વારા ઉપરોક્ત અનઓડિટેડ નાણાંકીય પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ ૯મી ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા.

**યુનીફોસ એન્ટરપ્રાઈઝ લીમીટેડ** વતી રજનીકાન્ત દેવીદાસ શ્રોફ મેનેજુંગ ડિરેક્ટર ડીન : ૦૦૧<u>૮૦૮૧૦</u>